



સીટી ઓફ બ્રેમ્પટનનો 2022 સ્ટ્રીટ સ્વીપિંગ પ્રોગ્રામ શરૂ થયો છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 11, 2022) – સીટી ઓફ બ્રેમ્પટનને પોતાનો 2022 સ્ટ્રીટ સ્વીપિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. સ્ટ્રીટ સ્વીપિંગ (સફાઈ) કામગીરી રહેણાક વિસ્તારના માર્ગો પર શરૂ થતા પહેલાં ઔદ્યોગિક અને આર્ટરીયલ સ્ટ્રીટ્સ પર શરૂ થશે.

માર્ગો અને ગટર સાફ રાખવા વસંત ઋતુ દરમિયાન શહેરમાંથી રેતી અને કચરો વાળી લેવામાં આવે છે. આનાથી વરસાદી ગટર (સ્ટોર્મ સીવર)માં કચરો ભરાતો અટકે છે અને વાહન ચાલકો અને વટેમાર્ગીઓ માટે સુરક્ષિત અને સાફ માર્ગો પૂરા પાડી શકાય છે. સિંગ્રેગ સ્વીપિંગ પ્રોગ્રામમાં નીચેની બાબતો સામેલ છે:

- સીટીની માલિકીના બ્રિજ્જસ, કેચ બેસિન્સ (કૂડીઓ) અને ગટરો સહિત, રસ્તા પર ડામરનું આવરણ ચઢાવેલા બધાં રસ્તાઓ
- સખત સપાટીવાળા બુલેવાર્ડ્સ અને મીડિયન્સ
- શિયાળા દરમિયાન સીટી દ્વારા પાવડાથી સાફ કરાતા સાર્ઇડવૉક્સ (ફૂટપાથ) અને વૉકવેઝ
- સીટી ઓફ બ્રેમ્પટનના રિક્રિએશન સેન્ટર્સ અને સીટીની અન્ય સગવડોમાં પાર્કિંગ લૉટ્સ
- કબર્સ વગરના ગ્રામ્ય રસ્તાઓને જરૂરિયાત મુજબ ધોવામાં અને/અથવા વાળીને સાફ કરવામાં આવે છે
- સાર્ઇડવૉકની સફાઈ
- સોલ્ટ બોક્સીસ અને બરફની વાડ કાઢી નાખવી
- પાવર વોશિંગ બુલેવાર્ડ્સ
- સોડ રિપેર (જમીનની સપાટીનું સમારકામ)
- સીટીના પાર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથેની ભાગીદારીમાં ગંદવાડો ઉપાડવો

સિંગ્રેગ સ્વીપ પ્રોગ્રામ દરમિયાન, રહેવાસીઓને નીચેની બાબતો યાદ અપાવવામાં આવે છે:

- સોમવારથી શુક્રવાર, સવારે 7 થી બપોરે 4 વાગ્યા સુધી આવાસીય માર્ગો પર વાહનો પાર્ક કરવા નહીં
- ડ્રાઈવવેઝ પર પાર્ક કરેલા વાહનો સ્ટ્રીટ પર જૂમી ન રહ્યાં (લેંગ ઓવર ના) હોવાની ખાતરી કરો
- કચરો લેવાના દિવસોએ કચરાના પાત્રો અને રિસાઈકલિંગ બોક્સીસને રસ્તાથી દૂર રાખો
- બાસ્કેટ બૉલ અને હોકી નેટ્સને રસ્તા પર ન રાખો અને કર્બથી પૂરતી પાછળ રાખો
- સમજદાર બનો. સ્ટ્રીટ સફાઈ કામગીરી થઈ રહી હોય ત્યારે, ઘોંઘાટ થવાની અને ધૂળ ઉડવાની શક્યતા રહે છે
- ઠંડું અને વરસાદી હવામાન સ્ટ્રીટ સ્વીપર્સને કામ કરતા રોકતું હોવાને લીધે ધીરજ રાખશો. આ કાર્યક્રમ ચાલુ રહે તે માટે ઉષ્ણતામાન સતતપણે શૂન્યથી ઉપર રહે તે જરૂરી છે

સિંગ્રેગ સ્વીપિંગ પ્રોગ્રામ અને સિંગ્રેગ સ્ટ્રીટ સ્વીપિંગ નક્શા વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ Brampton.ca જુઓ.